

Assignment Topics (2023-24)

B.Com Sem-5

ક્રમ	વિષયનું નામ	ટોપીકનું નામ
1	English	1. Write a Story of “ The Boy who broke the bank “ in your simple language 2. Write the story of “ Three Questions “ in Your simple language
2	Indian Economy-1	1. ધંધાકીય પર્યાવરણ એટલે શું ? ધંધાકીય પર્યાવરણના ઘટકો સમજાવો 2. વિકાસમાં રાષ્ટ્ર તરીકે ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો
3	Business Mathematics & Statistics-1	1. દ્વીપદી વિતરણની સમજૂતી આપી ગુણધર્મો અને ઉપયોગ લખો. 2. સહસંબંધ વિષે સમજ આપી પ્રકારની ચર્ચા કરી તેના માપ વિષે સમજાવો.
4	Auditing and Corporate Governance-1	1. નામા પદ્ધતિ અને ઓડિટીંગ નો અર્થ આપી અને સમજાવો કે નામા પદ્ધતિ જરૂરિયાત છે જ્યારે ઓડિટીંગ એક વૈભવ છે. 2. ભારતિય કંપની ધારા 2013 મુજબ કંપની ઓડિટરની લાયકાત ; ગેર લાયકાત; નિમણૂક; હકો અને ફરજો સમજાવો
5	Tally-1	1. ખાતાના પ્રકારો જણાવી ઉદાર-જમાના નિયમો જણાવો 2. Tally ERP-9 ના મુખ્ય હિસાબી વાઉચરો સમજાવો
6	Business Management-5	1. માર્કેટિંગ એટલે શું ? માર્કેટિંગનું મહત્વ અને તેના લક્ષણો જણાવો 2. પેદાશ એટલે શું ? નવી પેદાશ વિકાસ પ્રક્રિયાના તબક્કા જણાવો

7. Management Accounting- 1

1. અનુ લિ. નાં વર્ષ 2021 અને વર્ષ 20022 નાં પાકા સરવૈયા નીચે મુજબ છે.

જવાબદારીઓ	31-3-2021	31-3-2022	મિલકતો	31-3-2021	31-3-2022
ઈ. શેર દરેક રૂ. 100 નો પૂર્ણ ભરપાઈ સામાન્ય અનામત	4,50,000 2,25,000	7,50,000 1,50,000	પેટન્ટ પ્લાન્ટ-ચંત્રો જમીન-મકાન	30,000 5,25,000 4,50,000	10,000 6,75,000 4,05,000

નફા-નુકશાન ખાતું	2,22,000	2,07,000	પાઘડી	1,20,000	1,10,000
9 % ના ડિબેન્ચર્સ	1,50,000	2,10,000	રોકાણો	1,20,000	1,12,500
લેણદારો	1,20,000	90,000	સ્ટોક	60,000	1,20,000
દેવી હૂંડી	1,00,000	1,40,000	રોકડ	--	60,000
નહીં ચૂકવેલ ખર્ચા	27,500	10,000	દેવાદારો	1,00,000	1,40,000
કરવેરાની જોગવાઈ	90,000	1,20,000	લેણીહૂંડી	35,000	25,000
બેન્ક ઓવરડ્રાફ્ટ	82,500	--	પ્રાથમિક ખર્ચા	27,000	18,000
			ડિબેન્ચર વટાવ	--	1,500
	14,67,000	16,77,000		14,67,000	16,77,000

વધારાની માહિતી

- (1) કંપનીએ રૂ. 30,000ની મૂળ કિંમતના રોકાણો વેચાણ કિંમત ઉપર 20% નફાથી વેચેલ છે.
 - (2) તા. 1-4-2021 ના રોજ સામાન્ય અનામતમાંથી દર ત્રણ શેરદીઠ એક શેર બોનસ તરીકે આપવામાં આવેલ હતા.
 - (3) વર્ષ દરમિયાન 5% વટાવ થી નવા ડિબેન્ચર બહાર પાડ્યા હતા.
 - (4) વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા અને ડિવિડન્ડ અનુક્રમે રૂ. 82,500 અને રૂ. 81,000 છે.
 - (5) વર્ષ દરમિયાન રૂ. 75,000 ની ચોપડે દર્શાવેલ કિંમતના ચંત્રો 20% ખોટથી વેચ્યા હતા.
 - (6) વર્ષ દરમિયાન ચંત્રો પર રૂ. 52,500 અને જમીન-મકાન પર રૂ. 45,000 ઘસારો માંડી વાળેલ.
- ઉપરની માહિતી પરથી હિસાબી ધોરણ નંબર -3 મુજબનું રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. જરૂરી ગણતરી સાથે.

2. માનસ લિ. ના પાકા સરવૈયા વર્ષ 2022 અને વર્ષ 2021ના નીચે મુજબ છે.

જવાબદારીઓ	31-12-2022	31-12-2021	મિલકતો	31-12-2022	31-12-2021
10 % ના પ્રેફ. શેર			જમીન	1,00,000	2,00,000
દરે રૂ. 10 નો રૂ. 8			મકાન	2,40,000	1,72,500
લેખે ભરપાઈ	--	4,00,000	પ્લાન્ટ	8,50,000	7,50,000
ઈ. શેર દરેક રૂ. 10			સ્ટોક	1,17,000	1,22,400
નો પૂર્ણ ભરપાઈ	7,50,000	6,00,000	દેવાદારો	4,23,000	5,27,600
શેર પ્રીમિયમ	--	5,000	રોકડ સિલક	1,00,000	77,500
મૂડી અનામત	25,000	--	અ. ચૂકવેલ ખર્ચ	15,000	12,500
મૂડી પરત અનામત	3,50,000	--	લેણીહૂંડી	30,000	17,500
સામાન્ય અનામત	2,00,000	4,50,000	પરચુરણ ખર્ચ	1,25,000	1,20,000
નફા-નુકશાન ખાતું	2,50,000	2,00,000			
પ્રોવિડન્ટ ફંડ	50,000	50,000			
લેણદારો	75,000	1,00,000			
દેવી હૂંડી	3,00,000	1,95,000			
	20,00,000	20,00,000		20,00,000	20,00,000

વધારાની માહિતી

- (1) આગળના વર્ષમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10 % ઓછી આંકવામાં આવેલ હતી. તે વર્ષ 2018 થી મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કરેલ છે. તા. 31-12-2023 ના રોજ સ્ટોક તેની મૂળ કિંમતે દર્શાવેલ છે.
 - (2) ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ કાયદાની જોગવાઈઓનું પાલન કરીને પ્રેફરન્સ શેર 5 % પ્રીમિયમથી પરત કરેલ છે. આ માટે સામાન્ય અનામતમાંથી જરૂરી રકમ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવી છે.
 - (3) ઈક્વિટી શેર મૂડી પર 25% લેખે ડિવિડન્ડ જાહેર કરેલ છે.
 - (4) વર્ષ દરમિયાન કંપનીએ પ્લાન્ટ પર રૂ. 75,000 ધસારાની જોગવાઈ કરેલ છે, તેમજ રૂ. 25,000 ની ચોપડે દર્શાવેલ કિંમતનો પ્લાન્ટ રૂ. 5,000 ની ખોટ થી વેચેલ છે.
 - (5) જમીનનો એક ટૂકડો વેચેલ છે, જેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલો છે.
 - (6) વર્ષ દરમિયાન પરચુરણ ખર્ચા રૂ. 25,000 ચૂકવેલ છે.
- ઉપરની માહિતી પરથી ભંડોળ પ્રવાહ પત્રક જરૂરી ગણતરી સાથે તૈયાર કરો.

8. Accounting-5

1. હેતલ તેમના હિસાબો એકનોંધી પદ્ધતિથી રાખે છે. નીચેની માહિતી પરથી તેમનું તા. 31-3-2012ના રોજ પૂરા થતાં વર્ષનું વેપાર ખાતું, નફા-નુકશાન ખાતું તથા તા. 31-3-2023ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરો.

- (1) મિલકત અને દેવાઓ

વિગત	1-4-2022	31-3-2023
જમીન-મકાન	1,00,000	?
પ્લાન્ટ-ચંત્રો	1,20,000	?
રોકડ સિલક	?	1,75,000
સ્ટોક	50,000	50,000
લેણદારો	?	1,00,000
દેવાદારો	1,10,000	?
દેવીહૂંડી	40,000	?
લેણીહૂંડી	?	40,000

- (2) તા. 31-3-2023 ના રોજ પૂરા થતાં વર્ષના રોકડ વ્યવહારો

દેવીહૂંડીના ચૂકવ્યા	60,000
હેતલનો ઉપાડ	20,000
લેણદારોને ચૂકવ્યા	1,50,000
પગાર ચૂકવ્યો	30,000
મજૂરી ચૂકવી	20,000
ઓફિસ ખર્ચા ચૂકવ્યા	10,000

આગનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું	10,000
લેણીફૂંડીના વસુલ મળ્યા	1,20,000
દેવાદારો પાસેથી કુલ વસૂલ	3,12,500
(ઘાલખાધ પરત રૂ. 12,500 સહિત)	

(3) અન્ય વધારાની માહિતી

ઉધાર વેચાણ	4,00,000
ઉધાર ખરીદી	3,00,000
મળેલ વટાવ	10,000
આપેલ વટાવ	8,750
ખરીદ પરત	10,000
વેચાણ પરત	20,000
મળેલ લેણીફૂંડી	1,00,000
સ્વીકારેલ દેવીફૂંડી	80,000

રોકડ વેચાણ અને રોકડ ખરીદી શૂન્ય છે.

(4) હવાલાઓ

- (1) હેતલની શરૂઆતની મૂડી ઉપર 10% વ્યાજ ચૂકવવાનું છે.
- (2) જમીન-મકાન પર 12% અને પ્લાન્ટ-ચંત્રો પર 7.5% ઘસારાની જોગવાઈ કરો
- (3) દેવાદારો ઉપર 10% ઘાલખાધ અનામતની જોગવાઈ કરો.

2. એક વસ્તુ A, B અને C ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યારબાદ તેને તૈયાર માલના સ્ટોક ખાતે ફેરવાય છે. પ્રક્રિયા A નું ઉત્પાદન ફેરબદલી કિંમત પર 25 % નફા લેખે પ્રક્રિયા B ખાતે અને પ્રક્રિયા B તથા C નું ઉત્પાદન દરેકની ફેરબદલી કિંમત પર 20 % નફા લેખે ફેરવવામાં આવે છે.

વિગત	પ્રક્રિયા A	પ્રક્રિયા B	પ્રક્રિયા C	તૈયાર માલ રૂ.
શરૂઆતનો સ્ટોક	5,000	6,000	4,000	15,000
પ્રત્યક્ષ માલસામાન	10,000	10,500	15,000	--
પ્રત્યક્ષ મજૂરી	7,500	7,500	8,000	--
કારખાના પરોક્ષ ખર્ચ	7,000	3,000	20,000	--
આખરનો સ્ટોક	2,500	3,000	2,000	7,500
શરૂઆતના સ્ટોક માટે આંતર પ્રક્રિયા નફો	--	1,000	1,000	5,500

પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક પ્રક્રિયા C માંથી જે કિંમતે મેળવવામાં આવે છે તે કિંમતે આંકવામાં આવેલ છે. તૈયાર માલના વેચાણની રકમ રૂ. 2,00,000 છે. તમારે તૈયાર કરવાના છે : પ્રક્રિયા ખાતા અને તૈયાર માલના સ્ટોકનું ખાતું.